



**NBU-11027**      Seat No. \_\_\_\_\_

**B. Sc. Certificate Course (C.O.P.) (Part-I)  
Examination**

**April / May – 2017**

**Medical Laboratory Technology : Paper - I  
(Gen. Home Science)**

**(Introduction to Lab. Technology)**

Time : 2 Hours]

[Total Marks :

સૂચના : દરેક પ્રશ્નોના ગુણ સરખા છે.

૧ ભાઈકોસ્કોપનો સિદ્ધાંત અને કાર્યપદ્ધતિ સમજાવો.

**અથવા**

૧ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારનાં ગ્લાસવેર વિશે સમજાવો

કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો.

૨ બેકટેરીયાની રચના (એનેટોભી) સમજાવો.

૩ કલોરીમીટરનો સિદ્ધાંત અને કાર્યપદ્ધતિ સમજાવો.

૪ સીરોલોજ એટલે શું ? વિવિધ પ્રકારનાં એન્ટીજન એન્ટીબોડી રીએક્શન સમજાવો.

૫ નિર્જતુનીકરણની વ્યાખ્યા લખો અને તેની વિવિધ પદ્ધતિ સમજાવો.

## **ENGLISH VERSION**

**Instruction :** All questions carry equal marks.

- 1** Explain principle and working of Microscope.

**OR**

- 1** Explain different types of glasswares used in laboratory.

Answer any two questions : (any **two**)

- 2** Describe structure/anatomy of Bacteria.

- 3** Explain principle and working of colorimeter.

- 4** What is serology ? Explain different types of Antigen-antibody reaction.

- 5** Define sterilization and explain different method of sterilization.
-